

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનમાં જલદી જ વધુ સારી જીઓ (GO) સેવાઓ આવી રહી છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 ઓગસ્ટ 2019) - આજે પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો દ્વારા વિસ્તરિત જીઓ (GO) સેવાઓ તમામ મુખ્ય લાઈન્સ માટે જાહેર કરવામાં આવી જેમાં વિશિષ્ટ સુધારાઓ હશે જે બ્રેમ્પટનના મુસાફરો અને મુલાકાતીઓ માટે લાભદાયી નીવડશે.

વધારાની સેવામાં કુલ 84 નવી સાપ્તાહિક સફરો કિચનર (Kitchener), લેક્શોર ઈસ્ટ (Lakeshore East) અને લેક્શોર વેસ્ટ (Lakeshore West) જીઓ (GO) લાઈન્સ અને કિચનર (Kitchener) તેમજ લેક્શોર વેસ્ટ (Lakeshore West) વચ્ચે 65 વિસ્તારિત સાપ્તાહિક સફરો સામેલ છે.

બ્રેમ્પટન માટે મુખ્યત્વે નીચેનાં મુદ્દાઓનો સમાવેશ થાય છે:

- નવી સેવાથી બ્રેમ્પટન હવે કિચનર(Kitchener) જીઓ (GO) લાઈન પર 50 સાપ્તાહિક ટ્રેઈનની સફરો માણશે
- યુનિયન સ્ટેશન (Union Station) અને કિચનર (Kitchener) જીઓ (GO) વચ્ચે નવી મોડી રાતની સાપ્તાહિક સેવા
- સપ્તાહનાં ચાલુ દિવસોમાં યુનિયન સ્ટેશન (Union Station) અને બ્રેમલિ (Bramalea) જીઓ (GO) વચ્ચે દર કલાકે અપાતી સેવા
- સપ્તાહના ચાલુ દિવસોમાં યુનિયન સ્ટેશન (Union Station) થી બ્રેમલિ (Bramalea) જીઓ (GO) વચ્ચે એક્સપ્રેસ સફર પછી પશ્ચિમ તરફ જતાં કિચનર(Kitchener) જીઓ (GO) સુધી તમામ સ્ટેશને રોકાશે જેથી બ્રેમ્પટનનાં મુસાફરો ઓછામાં ઓછી 10 મિનિટ બચાવી શકશે.

બ્રેમ્પટન માટે નવા સેવાનાં સુધારા સપ્ટેમ્બર 3ના રોજથી અમલી બનશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સમપત્રકની વધુ વિગતો અહીં [GO ટ્રાન્ઝિટની વેબસાઈટ](#) પર મળી શકશે.

આ GO સેવા વિસ્તરણ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ દ્વારા થોડા સમય પહેલા જ થયેલ નવા [સેવાનાં સુધારાની જાહેરાત](#) બાદ આવી રહ્યું છે.

અવતરણો

"આ જાહેરાતની રાહ જોવાતી હતી અને બ્રેમ્પટનવાસીઓ માટે આ શુભ સમાચાર છે. "અમારું લક્ષ્ય બંને બાજુ ચાલતી આખા દિવસની બ્રેમ્પટન માટેની GO સેવા આપવાનું છે પરંતુ અમારું આ સોપાન તે તરફ ઉપાડેલ પગલું ગણી શકાય જેથી પ્રવાસ વધુ સરળ અને સુગમ બનશે જેથી બ્રેમ્પટનમાં વ્યાપારિક રોકાણ કરવાનું વધુ મજબૂત કારણ બની શકે જે ઈનોવેશન કોરીડોરમાં આર્થિક વિકાસનું સમર્થન કરશે."

- મેયર પેટ્રિક બ્રાઉન (*Mayor Patrick Brown*)

"વધારેલ બ્રમ્પટન ટ્રાન્ઝિટ સેવા જેનો સપ્ટેમ્બરથી અમે અમલ કરીશું અને આજની જાહેરાતને સાથે જોતા બ્રમ્પટનવાસીઓ માટે તો આ હર્ષનાં સમાચાર છે. બ્રમ્પટનમાં તમામ પ્રકારનાં સાર્વજનિક પરિવહનનાં વિકાસથી અમે રોમાંચિત છીએ અને અમે તમામ ભાગિદારો અને હિસ્સેદારો સાથે મળીને એવા વધુ માર્ગો શોધવાનું કાર્ય કરી રહ્યા છીએ જેથી એક મજબૂત, ટકાઉ ટ્રાન્ઝિટ સિસ્ટમનું સર્જન ચાલુ રહે."

- આલેક્સ મિલોજેવિચ (*Alex Milojevic*), જનરલ મેનેજર, બ્રમ્પટન ટ્રાન્ઝિટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca